

Seat No. : _____

N32-121

December-2014

F.Y.B.Com., (Annual Pattern)

Economics – 1

(ધંધાકીય અર્થશાસ્ત્ર – 1)

Time : 3 Hours]

[Max. Marks : 70

1. રોબિન્સ દ્વારા પ્રસ્તુત અર્થશાસ્ત્રની વ્યાખ્યા ચર્ચો. રોબિન્સની અર્થશાસ્ત્રની વ્યાખ્યાની ટીકાત્મક ચર્ચા કરો. 14

અથવા

માંગની મૂલ્ય સાપેક્ષતા એટલે શું ? માંગની મૂલ્ય સાપેક્ષતાને અસર કરતાં પરિબલો ચર્ચો.

2. સમઉત્પાદનરેખા અને સમખર્ચરેખાની મદદથી ઈષ્ટતમ સાધનસંયોજનનું વિશ્લેષણ કરો. 14

અથવા

સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચનો અર્થ આપી સીમાંત ખર્ચ અને સરેરાશ ખર્ચનો સંબંધ આકૃતિ સહિત ચર્ચો.

3. પૂર્ણ હરીફાઈમાં પેઢીની ટૂંકાગાળાની સમતુલા આકૃતિઓની મદદથી સમજાવો. 14

અથવા

કિંમત ભેદભાવ એટલે શું ? કિંમત ભેદભાવ ક્યારે શક્ય અને નફાકારક બને ?

4. વહેંચણીનો સીમાંત ઉત્પાદકતાનો સિદ્ધાંત મર્યાદાઓ સહિત સમજાવો. 14

અથવા

ભાડા અંગેનો રિકાર્ડોનો સિદ્ધાંત ટીકાત્મક રીતે સમજાવો.

5. ટૂંકનોંધ લખો : (ગમે તે બે) 14

- (A) અલ્પહસ્તક ઈજારોમાં ખાંચાવાળી માંગરેખા
(B) વ્યાજ અંગેનો કેઈન્સનો સિદ્ધાંત
(C) નફાનો નવપ્રવર્તનનો સિદ્ધાંત
(D) અર્થતંત્રની મૂળભૂત સમસ્યાઓ
(E) ઉત્પાદન વિધેય

Seat No. : _____

N32-121

December-2014

F.Y.B.Com., (Annual Pattern)

Economics – 1

(ધંધાકીય અર્થશાસ્ત્ર – 1)

Time : 3 Hours]

[Max. Marks : 70

1. Discuss the definition of economics given by Robinson. Critically discuss Robinson's definition of Economics. **14**

OR

What is price elasticity of demand ? Explain the factors affecting the price elasticity of demand.

2. Explain the least cost combinations of factors with the help of Iso-quant curve and Iso-cost curve. **14**

OR

Give the meaning of average cost and marginal cost. Discuss the relationship between marginal and average cost with the help of diagram.

3. Explain the short run equilibrium of a firm with help of diagram under perfect competition. **14**

OR

What is price discrimination ? When is price discrimination possible and profitable ?

4. Explain the marginal productivity theory of distribution with limitations. **14**

OR

Critically explain the Ricardian theory of rent.

5. Write short notes : (any **two**) **14**

- (A) Kinked demand curve of oligopoly
- (B) Keynes's theory of interest.
- (C) Innovation theory of profit.
- (D) Basic problems of Economics
- (E) Production Function.